

M.A. Semester - 2 (CBCS) Examination**March/April -2019 (Old Course)****ECONOMICS OF FINANCIAL MARKETS AND INSTITUTIONS (ELECTIVE)****Time: 2:30 Hours****Marks: 70****Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન-૧	ભારતના અર્થતંત્રમાં નાણાબજારનો ફાળો અને તેનું માળખું સમજાવો. અથવા	(૧૪)
પ્રશ્ન-૧	કોર્પોરેટ ફાઇનાન્સનો અર્થ આપો અને કોર્પોરેટ ફાઇનાન્સની વિવિધ પદ્ધતિઓ વિગતવાર સમજાવો.	
પ્રશ્ન-૨	જામીનગીરીઓના સામાન્ય લક્ષણો વર્ણવો. અથવા	(૧૪)
પ્રશ્ન-૨	સરકારી બોન્ડ અને ઇન્ડેક્સ લિંકેડ બોન્ડ વિશે સમજૂતી આપો.	
પ્રશ્ન-૩	સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) અને તેના કાર્યો સમજાવો. અથવા	(૧૪)
પ્રશ્ન-૩	ભારતના નાણાબજારના તાજેતરના સુધારાઓ સમજાવો.	
પ્રશ્ન-૪	આર્બિટ્રેજ પ્રાઇસિંગ થિયેરી વિગતવાર સમજાવો. અથવા	(૧૪)
પ્રશ્ન-૪	વિદેશ વિનિમય બજારનો પરીચય આપી તેનું સ્વરૂપ સમજાવો.	
પ્રશ્ન-૫	સમજાવો. (કોઇપણ બે) (૧) નાણાકીય સંચાલનના ધ્યેયો સમજાવો. (૨) મ્યુચ્યુઅલ ફંડ સમજાવો. (૩) કાર્યક્ષમ બજાર પરીકલ્પના સમજાવો. (૪) નાણાકીય સંચાલનના હેતુઓ.	(૧૪)

ENGLISH VERSION

Que-1	Explain the role and structure of financial market in Indian economy. OR	(14)
Que-1	Give the meaning of corporate finance and explain the various methods of corporate finance in detail.	
Que-2	Describe the general characteristics of securities. OR	(14)
Que-2	Explain on Government bonds and indexed linked bonds.	
Que-3	Explain the security and Exchange Board of India and its functions in detail OR	(14)
Que-3	Explain the recent reforms of Indian financial markets.	
Que-4	Explain the Arbitrage pricing theory in detail. OR	(14)
Que-4	Explain the foreign exchange market and its nature.	
Que-5	Explain: (any two) (1) Explain the goals of financial management. (2) Explain the mutual fund. (3) Explain the efficient market hypothesis. (4) Goals of financial management.	(14)
